

May 25, 2024

To,

**BSE Limited,** 

Department of Corporate Affairs, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai-400001 Maharashtra, India **Scrip Code: 500159** 

**Security ID: METROGLOBL** 

ISIN: INE085D01033

**Subject:** 

Publication of Newspaper Advertisements - Audited Financial Results (Standalone and Consolidated) for quarter and financial year ended March 31, 2024

Reference:

Regulation 47 and 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir / Madam,

With reference to the subject matter and pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, we wish to inform you that the Board of Directors of the Company at its meeting held on Friday, May 24, 2024 has *inter alia* approved the Audited Financial Results (standalone and consolidated) for the quarter and financial year ended March 31, 2024. The aforesaid Financial Results were published in the following newspapers:

- 1. Business Standard (English)
- 2. Jai Hind (Gujarati)

A copy of the results published is attached herewith. These are also being made available on the website of the company at <a href="www.metrogloballimited.com">www.metrogloballimited.com</a>. You are requested to take the same on your record.

Thanking you,

For Metroglobal Limited

#### **Hetal Koradia**

Company Secretary and Compliance Officer Membership No. A56454

**Encl.** As above

**Registered Office:** 506-509, "SHILP", Opp. Girish Cold Drinks, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat CIN: L21010GJ1992PLC143784 Phone: 91-79-2646 8016, 2646 9150, 2640 3930

Email: <a href="marketing@metroglobal.in">marketing@metroglobal.in</a> Web: <a href="mailto:www.metrogloballimited.com">www.metrogloballimited.com</a>

#### Johnson Controls-Hitachi Air Conditioning India Limited

Regd. Office: 9th Floor, Abhijeet, Mithakhali Six Roads, Ahmedabad: 380 006 CIN: L29300GJ1984PLC007470 Tel: + 917926402024, E-mail: hitachi@jci-hitachi.com, Website: www.jci-hitachi.in EXTRACT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31/03/2024

Sr.	Particulars	Quarter (	ended	Year ended		
No.		31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023	
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)	
1	Total income from operations	771.8	5,476.2	19,187.0	23,844.4	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or	668.3	45.6	(721.6)	(896.3)	
	Extraordinary Items)					
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/ or	650.6	21.6	(990.0)	(1,051.9)	
	Extraordinary Items)					
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or	162.5	32.2	(232.9)	(230.5)	
	Extraordinary Items)					
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)	47.8	(4.3)	(762.0)	807.0	
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]					
6	Equity Share Capital (Face value Rs.10 per share)	271.9	271.9	271.9	271.9	
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited			5,557.8	6,319.8	
	Balance Sheet of previous year)					
8	Basic and Diluted Earnings Per Share (before and after extra ordinary	18.0	(0.4)	(27.8)	(30.2)	
	items) (of Rs. 10 each) (Not annualised) (Rs.)					

Notes

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com, www.nseindia.com) and the company's website(www.jci-hitachi.in).

2. The above financial results are prepared in compliance with Indian Accounting Standard ("Ind AS") as notified under section 133 of the Companies Act, 2013 ("the Act") [Companies (Indian Accounting Standards) Rules, 2015], as

Place: Mumbai Date: 23rd May, 2024 For and on behalf of the Board of Directors Sanjay Sudhakaran **Managing Director** 

#### 乙 METROGLOBAL

No.

Revaluation Reserve)

a) Basic

b) Diluted

Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for Quarters) (Including Other Comprehensive Income)

#### Metroglobal Limited

Regd. Office: 506-509, Shilp, Opp. Girish Cold Drinks, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat. Email: cs@metroglobal.in, Website: www.metrogloballimited.com, CIN: L21010GJ1992PLC143784

STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31. 2024

			S	TANDALON	Ε			C	DNSOLIDATE	ΞD		ılt
	Particulars	Quarter Ended			Year	Ended	Quarter Ended			Year	Ended	Ш
•	Faiticulais	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	Ш
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited	Ш
	Total Income	6,583.90	7,118.51	8,023.67	24,592.43	24,772.26	6,593.36	7,120.50	8,023.78	24,604.51	24,772.97	Ш
	Net Profit / (Loss) for the period											Ш
	(before Tax, Exceptional and/or											Ш
	Extraordinary items)	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.81	Ш
	Net Profit / (Loss) for the period											Ш
	before tax (after Exceptional and/or	4 000 04	504.07	044.00	0.000.04	0.400.40	4.050.00	540.74	044.00	0.400.00	0.400.04	Ш
	Extraordinary items)	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.81	Ш
	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or											Ш
	Extraordinary items)	792.86	403.38	719.49	1.588.64	1,907.49	815.38	401.04	718.80	1,628.49	1,913.14	Ш
	Total Comprehensive income for the	732.00	400.00	710.40	1,000.04	1,507.45	010.00	401.04	7 10.00	1,020.40	1,510.14	Ш
	period	727.71	1.248.73	(931.09)	3.650.98	476.02	761.73	1,253.74	(852.77)	3,730.48	560.68	Ш
	Equity share capital (Face Value of	,,,,	.,	(==)	-,-50.00			.,	(/	-,. 300	110.00	Ш
	Rs 10/- each )	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	1,233.44	ılŀ
	Reserve and Surplus (excluding	-	-	-	35,726.55	32,383.93	-	-	-	35,801.37	32,387.65	Ш

The above financial results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at its meeting held on May 24, 2024. The standalone and consolidated financial results of the Company have been audited by the Statutory Auditors of the company.

29.60

29.60

3.86

3.86

These financial results have been prepared in accordance with applicable Indian Accounting Standards ("Ind As") notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended, as specified in section 133 of the Companies Act, 2013.

3 The Board of Directors have recommended a dividend of Rs. 2/- @20% per Equity share of face value of Rs. 10/- each, subject to approval from the shareholders at the ensuing AGM.

Previous period figures have been regrouped/rearranged whenever necessary for comparison purposes The Financial Results are available on the BSE Limited website www.bseindia.com & on the company's website www.metrogloballimited.com

For and on behalf of Board of Directors Metroglobal Limited

(7.55)

(7.55)

(6.91)

(6.91)

10.16

10.16

6.18

6.18

Date: May 24, 2024

(Gautam M. Jain) Chairman & Managing Director DIN: 00160167

30.24

4.55

4.55

(EMD):

## 250<sup>®</sup> Ambalal Sarabhai Enterprises Limited<sup>®</sup> ast

CIN: L52100GJ1978PLC003159

5.90

5.90

10.12

10.12

Regd. Office: Shanti Sadan, Mirzapur Road, Ahmedabad - 380001

Phone: 079-25507671, 25507073 | Website: www.ase.life | E-mail: ase@sarabhai.co.in

## EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH. 2024

(₹ in Lakhs, except per share data) Quarter ended Year ended **Particulars** 31.03.2024 | 31.12.2023 | 31.03.2023 | 31.03.2024 | 31.03.2023 Audited Audited Unaudited Audited Audited 18394.52 Total Income from Operations 18277.28 5913.49 4447.35 4880.01 (Including Other Income) Net Profit / (Loss) for the period 829.10 (before tax and exceptional items) 203.44 715.08 665.10 1517.21 Net Profit / (Loss) for the period 829.10 203.44 1517.21 before tax and after exceptional items 715.08 665.10 Net Profit / (Loss) for the period after tax and exceptional items 901.83 133.28 568.07 1144.79 571.16 Total Comprehensive Income for the period {Comprising Profit / (Loss) for the period 922.12 108.81 538.94 632.65 1071.21 (after tax) and Other Comprehensive Income (after tax)} Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- Per Share) 7663.33 7663.33 7663.33 7663.33 7663.33 Other Equity as shown in the Audited Balance Sheet of the previous year 6049.95 5428.98 Earnings Per Share (of ₹10/- each) Basic and Diluted Earning Per Share 1.18 0.18 0.76 0.74 1.49 (Not Annualized) (in ₹)

Notes:

Date: 24.05.2024

Place: Vadodara

1. Key numbers of Standalone Results are as under:									
		Quarter ended	Year ended						
Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023				
	Audited	Unaudited	Audited	Audited	Audited				
Total Income from Operations (including Other Income)	440.54	165.24	371.53	1170.34	1424.07				
Net Profit / (Loss) before tax	266.18	(38.46)	122.92	81.45	433.67				
Net Profit / (Loss) after tax	469.72	(65.09)	111.65	258.32	411.07				

- 2. The above is an extract of the detailed format of the Financial Results for the Quarter and year ended March 31, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results are available on the website of the Stock Exchange (www.bseindia.com) and the Company's Website (www.ase.life).
- The above financial results have been reviewed by the Audit Committee at their meeting held on 24th May, 2024 and approved by the Board of Directors at their meeting held on 24th May, 2024.
- These results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS) prescribed
- under Section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable. 5. The figures for the previous periods have been regrouped wherever necessary to conform to the current period's classification.

For, Ambalal Sarabhai Enterprises Limited Kartikeya V. Sarabhai Chairman

STATE BANK OF INDIA Retail Assets Central Processing Centre, 2nd Floor SWC Hub, SBI RACPC South, Vasna Bhayli Road, Opp Rajpath Vadodara.

See Rule 8(1) POSSESSION NOTICE (For immovable property) Whereas, The undersigned being the Authorized Officer of State Bank of India-RACPC-South under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act], 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 04.03.2024 calling upon the borrower Vijay Prajapati to repay the amount mentioned in the notic peing Rs 17,83,671/-(Rupees seventeen lakh eighty three thousand six hundred seventy one only) as on 03.03.2024 under Home Loan account 39769545986, 39790721160 further interest at the contractual rate and incidental expenses, costs, charges etc. thereon within 60 days from the date of receipt of the

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown) guarantor and the public in general that the undersigned has taken Symbolic **Possession** of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 8 of the said rules on thi 18th day of May of the year 2024.

The borrower, legal heirs (known - unknown), legal representatives (known unknown), guarantor and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of State Bank of India-RACPC-South for an amount of Rs 17,83,671/-(Rupees seventee lakh eighty three thousand six hundred seventy one only) as on 03.03.2024 under Home Loan account 39769545986, 39790721160 with further interest an incidental expenses, costs, charges etc. thereon.

The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Description of Equitable Mortgage of Immovable property

An immovable property of borrower /mortgagor comprising of land & buildings and erections thereon (both present and future) situated at all that piece and parcel of Mouje Sevasi, Block 283, 284 Old Survey No. 307, 308 TF no. 2(SEVASI) old FP no. 109,110 At Flat C /502 5th Floor Avadh Heights Sevasi Vadodara Reg. Dist Vadodara. Built Up area 60.20 Sqmtr, Undivided Common Plot & Land Area 24.35 Sqmtr. Bounded: East: Lagu Common Passage Dadar & open to Sky, West: Lagu Open to Sky, North: Lagu Open to Sky, South: Lagu Flat No. C /501.

Date: 25.05.2024 Authorised Office State Bank of India Place: Vadodara

PEGASUS

(Rs. In Lakhs except EPS)

PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED

PUBLIC NOTICE FOR SALE BY E-AUCTION Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the below mentioned Borrower( and Co-Borrower(s) that the below described secured assets being immovable properties. nortgaged/charged to the Secured Creditor, **Pegasus Assets Reconstruction Private Limited** acting in its capacity as Trustee of Pegasus Group Thirty Nine Trust 2 (Pegasus), having been assigned the debts of the below mentioned Borrower along with underlying securities interest by RBL Bank Ltd. vide Assignment Agreement dated 30/09/2021 under the provisions of the SARFAESI Act, 2002, are being sold under the provisions of SARFAESI Act and Rules thereunder on "As is where is", "As is what is", and "Whatever there is" basis with all known and inknown liabilities on 12/06/2024

The Authorized Officer of Pegasus has taken physical possession of the below described secured

assets being ininovable properties on 29/10/2023 under the provisions of the SARFAESTACL and							
Rules thereunder.							
THE DETAILS OF AUCTION ARE AS FOLLOWS:							
Name of the Borrower(s), Co-Borrower(s) and Guarantor(s):  a) Sarva Mangal Marketing (Borrower) b) Mr. Ramesh Bhagwandas Khandelwal (Co-borrower) c) Mr. Mahesh Gajanand Khandelwal (Co-borrower) d) Mrs. Ashadevi Rameshkumar Khandelwal (Co-borrower Mortgagor)							
Outstanding Dues for which the secured assets are being sold:	Rs. 17,72,411.14/- (Rupees Seventeen Lakhs Seventy Two Thousand Four Hundred Eleven And Paise Fourteen Only) as on 15/07/2021 as per notice under section 13(2) of SARFAESI Act. (Rs. 28,93,000 (Rs. Twenty Eight Lakhs Ninety Three Thousand Only) as on 01/02/2024 plus interest at the contractual rate and costs, charges and expenses thereon w.e.f. 02/02/2024 till the date of payment and realization.)						
Details of Secured Asset being Immovable Property which is being sold							

395001 Near Jal Darshan Apartment, Navdi Owaro, Bahumal Bhawan, Navdi, Nanpur, Surat 395001. **Boundaries are as fol** lows: Towards East: Open Space Towards South: Open Space Towards West: Passage Towards North: Lift Security Id: 40027096804 CERSAI ID: Asset Id: 200027044890 Reserve Price below which Rs. 14,48,000/the Secured Asset will not Rupees Fourteen Lakhs Forty-Eight Thousand Only) be sold (in Rs.): Earnest Money Deposit Rs. 1,44,800/-(Rupees One Lakh Forty-Four Thousand Eight Hundred Only)

Claims, if any, which have been put forward against the property and any othe dues known to Secured reditor and value nspection of Properties: 01/06/2024 between 01:00 p.m. to 03:00 p.m.
Contact Person and Phone No: Mr Nilesh More – 9004722468
Mr. Rohan Kadam- 9167981607 of Bid: ime and Venue of Bid E-Auction/Bidding through website (https://sarfaesi.auctiontiger.net) on 12/06/2024 from 11.00 a.m. to 01.00 p

This publication is also a fifteen (15) days' notice to the aforementioned Borrowers / Co-Borrowe under Rules 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002. For the detailed terms and conditions of the sale, please refer to Secured Creditor's website i.e.

http://www.pegasus-arc.com/assets-to-auction.html or website https://srafees.auctiontiger.net or contact service provider E Procurement Technologies Ltd. Auction Tiger Bidder Support Nos: Mo. +91 9265562821 & 9374519754, Email: <a href="mailto:support@auctiontiger.net">support@auctiontiger.net</a> before submitting any bid. AUTHORISED OFFICER Place: Surat Date: 25.05.2024

(Trustee of Pegasus Group Thirty Nine Trust 2)

DEBTS RECOVERY TRIBUNAL- I See Rec

Govt. of India, Ministry of Finance, Department of Financial Services
4nd floor, Bhikhubhai Chambers, 18, Gandhikunj Society, Nr. Kochrab Ashram, Ellisbridge, Ahmedabad-380 006 Established u/s.3 of the Recovery of Debts due to Banks & Financial Institution Act, 1993, for the area comprising Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan Sabarkantha (Himmatnagar), Banaskantha (Palanpur) of Gujarat State w.e.f. 1st June, 2007

(See Section 25 to 29 of the Recovery of Debts and Bankruptcy Act, 1993

read w	ith Rule 2 of Second Schedule of the Income T	ax Act-1961)
R.C. No. 195/2	014	O.A. No. 111/2012
BANK OF BAR	RODA, BAPUNAGAR BR. AHMEDABAD	Certificate Holder
V/S.		
M/S. SAI CREA	ATION & ONE ORS.	Certificate Debtor
<u>г</u> о	Demand Notice	

CD No.1 M/s. Sai Creation Proprietorship firm through its proprietor Mr. Jagdishbhai Kishorbhai Bunha CD No. 2 Mr. Jagdishbhai Kishorbhai Bunha. Proprietor of M/s. Sai Creation. of the Recovery Certificate issued in T.A./O.A./M.A./Misc. IA. /Exe. Pet.

No.111/2012 passed by the Hon'ble Presiding Officer, DRT-I, Ahmedabad an amount o

Rs.13,39,862=00 (Rupees: Thirteen lacs thirty nine thousand eight hundred sixty two

You are hereby called upon to deposit the above/below sum within 15 days of the receipt of the notice, failing which the recovery shall be made as per rules.

In additions to the sum aforesaid you will be liable to pay:

(a) Such interest & Cost as is payable in terms of Recovery Certificate (b) All costs, charges and expenses incurred in respect of the service of this notice and

other process that may be taken for recovering the amount due. Given under my hand and the seal of the Tribunal, this (Love Kumar)

08th day of April, 2024. Next Date: 01.07.2024

Recovery Officer-I DRT-I, Ahmedabad



only) (Decree amount) is due against you.

hmedabad-190001, Gujarat, India T +91 (0)79-2646926 F +91 (0)79-26426068 W :www.jkbank.net. E:ahamad@jkbmail.com CIN: L65110JK1938SGC000048 POSSESSION NOTICE

Notice under Section 13 (4) of the SARFAESI ACT, 2002 read with Rule 8 (1) of the Security (Enforcement) Interest Rules, 2002

ereas, the Authorised Officer of the Jammu & Kashmir Bank Limited under the s and reconstruction of Financial Assets and Enforcement of Security interest (SARFAES) Act, 2002 and tin of initiational Assets and Elinotectine to Section linetess (National Assets) and Elinotectine to Section 13(2) of the said Act read with Rule 3 of the Security interest (Enforcement)Rule 2002, issued Demand notice dated 05.02.2024, thereby calling upon the Borrowers namely Mrs. More Sweta Manoj Wo Sh. More Manoj R/o Flat No.A-701,7° Floor, Block-A, Narol-Vatva, Ahmedabad-382405 to repay an amount of Rs. 28,93761.10 (Rupees Twenty Eight Lacs ninety three Thousand seven hundred sixty one and paisa ten only) being the balance outstanding as 04.02.2024 in the accounts of Borrowers, within 60 days from the date of civil desire between the work of the property thereof the property that the property thereof the property that the property that the property that the property that the property thereof the property that the property the property that the propert e date of said notice together with the future interest and other charges thereon

The said borrowers having failed to repay the said amount, notice is hereby given to the said borrowers in particular and public in general that the undersigned being authorized officer of the J&K Bank Ltd. has taken possession of the mortgage property described herein below, in exercise of the powers conferred on me under section 13(4) of the said Act read with Rule 8 of the said ules, on this the 22<sup>nd</sup> day of May 2024. The said borrowers in particular and the public in genera are hereby cautioned against dealing with the said property in any manner whatsoever and an dealings with the said property will be subject to the charge of J&K Bank limited for the amount in aggregating to Rs.28,93,761.10 as on 04.02.2024 together with future interest thereon from 04.02.2024 and other charges incurred or to be incurred. The borrowers attention is invited to provisions of Sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem th

Description of the immovable property Mortgaged by the Borrowe Registered/Equitable Mortgaged Property "Residential Flat No.A-701,7°Floor, Block-A admeasuring about 52.31 sq.mtrs (Rera Carpet area) or (Built up area),togather with exclusive Wash-Balcony area admeasuring about 2.58 sq.mtrs. and undivided share in the land admeasuring 21.48 Sq.mtrs. in the Scheme Known as "Ganesh Heights" Constructed on N.A.land bearing final plot no.42/1 of T.P.Scheme No.80 in lieu of Survey No. 594/ situated at Mouje- Vatva,,Taluka -Vatva,District-Ahmedabad in the Sub-Distric Ahmedabad-11(Aslali).

Pandesara, Surat - 394221, (Guj.) Ph.: 0261 2891347 , 28995447 E-mail: indpan@bankofbaroda.com



SYMBOLIC POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 11-03-2024 calling upon the Borrower Mr. Lathiya issued a demand notice dated 11-03-2024 calling upon the Borrower Mr. Lathiya Mehul Dineshbhai (Borrower), Mr. Dineshbhai Balubhai Lathiya (Co-Borrower), Mrs. Sobhaben Dineshbhai Lathiya (Co-Borrower) & Mr. Jaysukh Vastapara (Gaurantor) to repay the amount mentioned in the notice being Rs. 12,42,248.89/-/-(Rupees Twelve Lakh Forty Two thousand Two hundred forty Eight Hundred and Eighty Nine Paise only) + interest from 11/03/2024 and other charges/commission/fees etc. within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules. 2002 on this the 20th May 2024

Rules, 2002 on this the **20th May 2024**The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with

His property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, IE Pandesara Branch, Pandesara, Surat for an amount of Rs. 12,42,248.89 (Rupees Twelve Lakh Forty Two thousand Two hundred forty Eight Hundred and Eighty Nine Paise only) + interest from 11/03/2024 and other charges/ Description of the immovable property

Immovable property belonging to Mr. Lathiya Mehul Dineshbhai (Borrower), Mr Dineshbhai Balubhai Lathiya (Co–Borrower), Mrs. Sobhaben Dineshbhai Lathiya

Co-Borrower).

All right,tittle and interest in the immovable property bearing Flat no .F 502 admeasuring built up area 722.00 Sq fts i.e 67.10sq .mtrs. on 5th floor of Building No."(6)" in the residential complex which is known and named as "GOPINATH" RESIDENCY" and the whole complex is situated on the non –agricultural land bearin (i)Revenue Survey no .465/2 paikee ,Block no 750 paikee no 2 admeasuring 304.00 sq, mtrs (ii)Revenue Survey no .467/1 paikee,Block no 750 paikee 1 admeasuring 3643.00 Sq mtrs ,(iii)Revenue Survey no 467/1 paikee,Block no 753 paikee Block no 754 paikee admeasuring 3643.00 Sq mtrs ,(iii)Revenue Survey no 467/2 & 467/3 paikee ,Block no 754 paikee 1 admeasuring 5564.00 Sq mtrs total admeasuring 9511.00 sq mtrs ,TP Scheme No 66(KOSAD)final Plot no 213 of Village :KOSAD Sub District :Surat City [New Sub District: Adajan], District Surat and the said property is surrounded as under:- The said property's Boundaries as under:- East - Flat No. F 501, West - Building No."G" North - Flat no F-503, South - Society Road.

Date: 20.05.2024 | Place : Surat Authorized Officer, Bank of Baroda.



Place: Chennai

Date : 24th May 2024

## **Coromandel Engineering Company Limited**

CIN No: L7490TN1947PLC000343

EXTRACT OF THE AUDITED FINANCIAL STATEMENTS FOR THE QUARTER AND YEAR ENDED 31<sup>ST</sup> MARCH 2024

Registered and Corporate Office: 'BASCON FUTURA' No.10/2, Old No. 56L, Venkatanarayana Road, T. Nagar, Chennai - 600 017. Email: general@cec.coromandel-group.com Website: www.coromandelengg.com

Rs. In lakhs (except										
PARTICULARS	Quarter ended 31-03-2024	Quarter ended 31-12-2023	Quarter ended 31-03-2023	Year ended 31-03-2024	Year ended 31-03-2023					
Total Income from Operations	2405.78	2,158.88	2609.37	9,663.81	12,651.10					
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or extraordinary items)	(21.58)	(73.68)	(211.86)	(383.07)	(583.83)					
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items )	(21.58)	(73.68)	(13.37)	(361.86)	(385.34)					
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	(16.17)	(106.74)	(47.64)	(439.71)	(450.86)					
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	(1.08)	-	(1.08)					
Paid-up Equity Share capital (Face Value of Rs.10 per share)	3,323.36	3,323.36	3,323.36	3,323.36	3,323.36					
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.				(5,371.79)	(4,919.85)					
Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -										
Basic : (Rs.)	(0.05)	(0.32)	(0.14)	(1.32)	(1.36)					
Diluted : (Rs.)	(0.05)	(0.32)	(0.14)	(1.32)	(1.36)					

The above results were reviewed by Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 24<sup>th</sup> May 2024

2. The above is an extract of detailed format of Audited Financial results for the Quarter and Year ended 31 March 2024 filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the stock exchange (www.bseindia.com) and Company's website (https://www.coromandelengg.com/)

For Coromandel Engineering Company Limited

Sabaretnam Singaram Managing Director DIN: 00042329

# સોનાના ઉંચા ભાવઃ જુના ગોલ્ડની અદલાબદલી વધશે

સંગઠિત સોનાના ઝવેરાતના છૂટક વિક્રેતાઓ ૨૦૨૪-૨૫માં વાર્ષિક ધોરણે ૧૭-૧૯ ટકાની આવક વૃધ્ધિની અપેક્ષા રાખે છે, જે દ્વારા સંચાલિત સોનાના ભાવમાં ઉછાળાને પગલે વેલ્યુમાં ઉછાળો જોવાશે, જયારે વોલ્યુમ સ્થિર રહેવાની

શકયતા છે. ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠીત ગોલ્ડ જવેલર્સની આવકમાં ૧૭-૧૯ ટકાનો વધારો થવાની ધારણા છે, જયારે સોનાના વધતા ભાવને કારણે વોલ્યમ ગ્રોથ અટકી જવાની શકયતા છે, એમ ક્રિસિલ રેટિંગ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો અને નવા સ્ટોરના વધારાને કારણે ઉંચા ઈન્વેન્ટરી સ્તરને કારણે રિટેલરોની

કાર્યકારી મૂડીની જરૂરિયાતો વધી શકે છે, જોકે, ક્રેડિટ પ્રોફાઈલ્સ સ્થિર રહેવી જોઈએ, એમ તેણે ઉમેર્યું હતું. સંગઠીત ક્ષેત્ર બજારના ત્રીજા ભાગ કરતાં થોડો વધ્

રૂા. ૬૭,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો હતો, એમ ક્રિસિલ રેટિંગ્સે જણાવ્યું એપ્રિલ ૨૦૨૪માં સોનાના ભાવમાં આશરે રૂા.૭૬,૦૦૦ સુધીનો વધારો

થયો હતો કારણ કે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે વિશ્વભરની વિવિધ કેન્દ્રીય બેંકો તેમજ અંતિમ ઉપભોકતાઓ દ્વારા જોવામાં આવતા સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંના એક તરીકે સોનાએ તેની ચમક જાળવી રાખી હતી. બ્રાંડિંગ અને માર્કેટીંગ ખર્ચમાં વધારો કરવા ઉપરાંત, રિટેલર્સ ખરીદદારોને

રાખ્યું છે. અમે માગ નીચે કેરેટની સોનાની જવેલરી તરફ વળવાની અપેક્ષા રાખીએ છીએ અને વોલ્યુમને ટેકો આપવા માટે ગોલ્ડ એક્સચેન્જ પ્રોગ્રામનું પ્રમોશન આગળ વધશે, એમ ક્રિસિલ રેટિંગ્સ ડિરેક્ટર આદિત્ય ઝાવરે જણાવ્યું હતું. પરિણામે મોટા ભાગના મોટા રિટેલર્સ માટે ગોલ્ડ એક્સચેન્જ સ્કીમનો હિસ્સો અકંદર વોલ્યુમના

લગભગ ત્રીજા ભાગથી વધવાની ધારણા છે.

વધુમાં સંગઠિત છુટક વિક્રેતાઓ અસંગઠિત લોકોના ભોગે બજાર હિસ્સો મેળવવાનું ચાલુ રાખશે. ગ્રાહકોની પસંદગીઓ અને સ્ટોરના વિસ્તરણને ટાવર ૧ અને ૨ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારો દ્વારા સમર્થન આપવામાં આવશે. ક્રિસિલ રેટીંગ્સે વધુમાં જણાવ્યું હતું કે, તંદુરસ્ત બેલેન્સ શીટ દ્વારા માગના ટેકાએ, સ્ટોર વિસ્તરણ (મુખ્યત્વે મોટા જવેલરી રિટેલર્સ દ્વારા)ને કારણે રોગચાળા પછી મજબૂત બે આંકડામાં વૃધ્ધિ જોવા મળી છે. સપાટ

શકે છે. સોનાના ભાવમાં વધારો થવાના પરિણામે આ નાણાકીય વર્ષમાં સોનાની હિસ્સો ઘરાવે છે, જેમાં અત્યંત વિભાજિત કિસીલનો રીપોર્ટ: ઝવેરી માર્કેટમાં જરૂરી ઈન્વેન્ટરી વધુ કિંમતે ઉચી રહેશે. આ, નવા સ્ટોર્સ પર અસંગઠિત ક્ષેત્રનો બાકીનો હિસ્સો છે. એકવાયર૪ કિસીલનો રીપોર્ટ: ઝવેરી માર્કેટમાં જરૂરી ઈન્વેન્ટરી સાથે, ઉચ્ચ કાર્યકારી મૂડીનું દેવું તરફ દરમિયાન સ્થાનિક સોનાના ભાવમાં ૧૫ ટકાનો **ટર્નઓવર વધરો પરંતુ 'વોલ્યુમ' સ્થિર રહેશે** દોરી જશે, જોકે, સ્તાપિત ગોલ્ડ જવેલરી રિટેલર્સને વધારો થયો હતો અને માર્ચ ૨૦૨૪ના અંતે

ા સુધારો થયો છે. આ મધ્યમ ગાળામાં ચાલુ રહેવાની ધારણા છે, એમ ઉમેર્યું હતું. સ્વસ્થ આવક વૃધ્ધિ અને પર્યાપ્ત નફાકારકતાને કારણે મજબૂત રોકડ

વોલ્યુમ જોતા ૨૦૨૪-૨૫માં સ્ટોર ઉમેરવાની ગતિ ૧૦-૧૨ ટકા સુધી મધ્યમ રહી

જનરેશન, કાર્યકારી મૂડી ઉધારવામાં અપેક્ષિત વધારો હોવા છતા, સંગઠીત ગોલ્ડ જવેલરી રિટેલર્સની ક્રેડિટ પ્રોફાઈલને સ્થિર રાખશે. ક્રિસિલ રેટિંગ્સ ડાયરેકટર હિમાંક શર્માએ જણાવ્યું હતું, નાણાકીય ૨૦૨૫માં દેવાનું ભારણ નિયંત્રણમાં રહેશે, નાણાકીય વર્ષ ૨૦૨૪ના સ્તરોથી માત્ર સહેજ મધ્યસ્થતા સાથે નેટ વર્થ અને વ્યાજ કવરેજ રેશિયોની કુલ બહારની જવાબદારીઓ અનુક્રમે ૧.૦-૧.૧ ગણા અને ૮.૦-૮.૨ ગણા અપેક્ષિત છે.



**પાંચકુવા ભ્રાન્ચ**ઃ ધનલક્ષ્મી બિલ્ડીંગ, બીબીસી માર્કેટ સામે, રેવડી બજાર, પોસ્ટ રેલ્વેપુરા,અમદાવાદ-૩૮૦૦૦૨, ગુજરાત, ઇન્ડીયા Phone no. 079-22141251, 22145710, Mobile No. 9978446541, www.bankofbaroda.com

"APPENDIX- IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

સિક્ચોરિટાઇગ્રેશન એન્ડ રિકન્સ્ટ્રકર્શના ઓફ ફાઇનાન્સિયલ એસેટસ એન્ડ એન્ફોરમિન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ અને સિક્ચોરિટી ઇન્ટરેસ્ટટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ ૨૦૦૨ના રુલ ૬(૨) અને રુલ ૮(૬) સાથે વંચાણે લેતાં સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટિસ. આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ઋણકર્તા (ઓ) અને ગેરન્ટર (રો)ને ખાસ કરીને નોટિસ આપીને જણાવવાનું કે નીચે જણાવેલ મિલકતો જે બેંક ઓફ બરોડાને હાઇપોથિકેટડ/ પ્લેજડ/ ચાર્જ હેઠળ /મોર્ગેજ કરેલી છે, જેનું બેંક ઓફ બરોડાના અધિકૃત અધિકારી દ્વારા પ્રત્યક્ષ કબજો મેળવી લીધેલ છે તેનું નીચે જણાવેલ મિલકતો **"જ્યાં છે જેમ છે, જે કંઇ છે તે છે ના આઘારે"** બેંકના બાકી લેણાની વસુલાત કરવા બેંક ઓફ બરોડા (સુરક્ષિત લેણદાર)નીચે જણાવેલ ખાતાઓની કંપની, પેઢી, ડાયરેક્ટર્સ, ભાગીદારો, ઋણકર્તાઓ અને જામીનદારો પાસથી ખાતાના લેણાંની વસુલાત માટે ઇ હરાજીથી વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઋણકર્તા/જામીનદાર/મિલકતો/બાકીની રકમ/ અનામત રકમ/બાનાની રકમ અને ઇ-હરાજીની તારીખ અને સમય નીચે દર્શાવ્યા મુજબ છે.

ક્રમ. લોટ નં.	ૠણકર્તા/ઓ/ જામીનદાર/રો ના નામ અને સરનામા	જાણીતા બોજા સાથેનું સ્થાવર મિલકતનું વિગતવાર વર્ણન, જો કંઇ હોય તો	ડીમાન્ડ નોહિસ મુજબ બાકી લેણાં (ડીમાન્ડ નોહિસ જારી કર્યા બાદ આવેલ રિક્વરી બાદ કરીને) વત્તા તેની પર વ્યાજ	રીઝર્વ પ્રાઇઝ, અર્નેસ્ટ મનિ ડીપોઝીટ ઇએમડી અને બીડ વધારાની રકમ
٩	જીતેન્દ્રભાઇ અંબાલાલ સોલંકી (ઋછકતાં) એકતાબેન જીતેન્દ્રભાઇ સોલંકી (સહ- ઋણકતાં)	જીતેન્દ્રભાઇ અંબાલાલ સોલંકી ની માલિકીની સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો-રહેણાંક પ્લોટ ઈ- ૧૧ એરીયા આશરે ૯૩ ચો.મી., આરએસ નં. ૨૯૭૧/ ૨, ૨૯૭૧/૨ પૈકી ૧, ૨૯૭૧/૨/૨ મોજે માણસા, તાલુકો માણસા, ૨જી. જિલ્લો ગાંધીનગર ખાતે આવેલ છે. ચતુઃસીમા: પૂર્વે માજીન પ્લેસ, પશ્ચિમે પબ્લિક વે, ઉત્તરે પ્લોટ નં. ૧૨, દક્ષિણે માર્જીન પ્લેસ	રૂા. ૭,૪૯,૨૦૬/- (રૂા. સાત લાખ ઓગણપચાસ હજાર બસો છ પૂરા) તા ૨૦-૦૨-૨૦૨૩ ના રોજ + કોન્ટ્રેક્ચ્યુઅલ રેટ મુજબ વ્યાજ અને અન્ય ખર્ચાઓ ત્યારબાદ આવેલી રીકવરી બાદ કરીને, જો કંઇ હોય તો. કલમ ૧૩(૨) તા. ૨૦-૦૨-૨૦૨૩ મુજબ ડીમાન્ડ નોટિસ	રીઝર્વ પ્રાઇઝ- રૂા. ૧૦,૦૦,૮૦૦/- ઇએમકી રૂા.૧,૦૦,૦૮૦/- બીડ વધારાની સ્કમ રૂા.૧૦,૦૦૦/-
5	જીતેન્દ્રભાઇ અંબાલાલ સોલંકી (ઋછકર્તા) એકતાબેન જીતેન્દ્રભાઇ સોલંકી (સહ- ઋઇકર્તા)	જીતેન્દ્રભાઇ અંગાલાલ સોલંકી ની માલિકીની સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો રહેલાંક પ્લોટ એક-૧૦ એરીયા આશરે ૯૦.૭૧ ચો.મી., આરએસ નં. ૨૯૭૧/૨, ૨૯૭૧/૨ પૈકી ૧, ૨૯૭૧/૨/૨ મોજે માણસા, તાલુકો માણસા, ૨જી. જિલ્લો ગાંધીનગર ખાતે આવેલ છે. ચતુઃસીમા: પૂર્વે માર્જીન પ્લેસ, પશ્ચિમે પબ્લિક વે, ઉત્તરે માર્જીન પ્લેસ.	એક્સઠ પૂરા)્તા ૨૦-૦૨-૨૦૨્૩ ના રોજૃ +	રીઝર્વ પ્રાઇઝ- રૂા. ૯,૮૮,૨૦૦/- ઇએમડી રૂા.૯૮,૮૨૦/- બીડ વધારાની ૨૬મ રૂા.૧૦,૦૦૦/-
3	મે. વાસ્તુ એક્વેરિયમ (પ્રોપ.જીતેન્દ્રભાઇ અંબાલાલ સોલંકી)	હૈપરોક્ત બન્ને મિલકતો મે. વાસ્તુ એક્વેરિયમ (પ્રોપ. જીતન્દ્રભાઇ અંબાલાલ સોલંકી) ને અપાયેલી સુરક્ષિત સુવિધા માટે પણ મોર્ગેજ કરવામાં આવી છે.	રા.૧૭,૨૯,૩૯૪/- (રા. સત્તર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ચોરાણું પૂરા) તા ૨૦-૦૨-૨૦૨૩ ના રોજ + કોન્ટ્રેક્ચ્યુઅલ રેટ મુજબ વ્યાજ અને અન્ય ખર્ચાઓ ત્યારબાદ આવેલી રીકવરી બાદ કરીને, જો કંઇ હોય તો. કલમ ૧૩(૨) તારીખ ૨૦-૦૨-૨૦૨૩ મુજબ ડીમાન્ડ નોટિસ	

શાશની વિગતવાર શરતો અને નિયમો માટે https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in પર આપેલ લિંક જોવા વિનંતી છે. ભાવિ

બીડરો અધિકૃત અધિકારી ના ઉપર જણાવેલ ટેલિફોન નંબર પર સંપર્ક કરી શકે છે.

१४.६१इतां/જામીનદારો/ मोर्गेજरूने आधी नोटिस आपवामां आवे छे डे तेओओ હરાજીની तारीण पढेला ઉपर જણાવેલ रङम (सेडशन ९३(२)नी नोटिस मुज्ज) ભरी हेवी અने जे तेम ङरवामां डसुर थशे तो सिड्थोर्ड मिलडतोनी હराજી डरवामां आवशे અने जाडी रहेती रङम व्याज અने

ર્ચા સાથે ઋણકર્તા/જામીનદારો/ મોર્ગેજર પાસેથી પણ વસૂલ કરવામાં આવશે

ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી, લેંક ઓક લરોડા

## વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરે તેવી શકયતા છે, તેમ છતાં તેઓ સોનાના ઉંચા ભાવ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે પ્રોડકટ ડિઝાઈન અને ઓફરિંગને વધારવાનું ચાલુ

## એક્ટ્રેસ લૈલા ખાનના હત્યારા પિતા પરવેઝને કોર્ટે આપી ફાંસીની સજા

મુંબઈ, તા.૨૪ એક્ટ્રેસ લૈલાં ખાન મર્ડર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુંબઈની સેશન કોર્ટે દોષિત પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ૧૩ વર્ષ બાદ કોર્ટે આ કેસમાં સજાની જાહેરાત કરી છે. પરવેઝ ટાક મૃતક લૈલા ખાનનો સાવકો પિતા છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં મહારાષ્ટ્રના ઈગતપુરીમાં એક ફાર્મ હાઉસ પર પરવેઝ ટાકે લૈલા ખાન અને તેના પરિવારના પાંચ અન્ય લોકોની નિર્મમ હત્યા કરી હતી અને લાશને જમીનની અંદર દાંટી દીધી હતી.

લૈલા ખાન મર્ડર કેસમાં ૯મેના રોજ સેશન કોર્ટે પરવેઝ ટાકને દોષિત ઠેરવ્યો હતો અને સજાની જાહેરાત પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હકીકતમાં જોઈએ તો. પ્રોપર્ટીને લઈને થયેલા વિવાદ બાદ પરવેઝ ટાકે પોતાની સાવકી દીકરી લૈલા ખાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં કાતિલ પરવેઝે લૈલાની માતા સહિત ૬ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના ફેબ્રુઆરી ૨૦૧૧ની છે.આ મામલામાં સૌથી પહેલા વર્ષ ૨૦૧૧માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ૬ લોકોની મિસિંગ ફરિયાદ આવી હતી.

## વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓની મિની બસને ટ્કે મારી ટક્કર : ૭ના મોત

અંબાલા, તા.૨૪ હરિયાણાના અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા છે. જે એક જ પરિવારના હતા. આ ઉપરાંત લગભગ ૨૫ લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે આ રોડ અકસ્માત દિલ્હી જમ્મૂ નેશનલ હાઇવે પર સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મિની બસમાં બેઠેલા લોકો વૈષ્ણો દેવી દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. રસ્તામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી અને મિની બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ૂબ્સમાં મુસાફરી કરનાર શિવાનીએ કહ્યું કે ડ્રાઇવર દારૂના નશામાં હતો. અકસ્માત બાદ સૌથી પહેલાં નિકળીને ભાગી ગયો. બસની અંદર ૩૦થી ૩૫ લોકો હતા અને વૈષ્ણોદેવી જઇ રહ્યા હતા. અમારી આંખ લાગી ગઇ હતી, ખબર ન પડી કે અકસ્માત કેવી રીતે સર્જાયો. યૂપીના બાંદામાં એક ભીષણ રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તો બીજી તરફ અડધો ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. તેથી ઓટોમાં સવાર તમામ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે લોકોના મોત થયા છે.

### adani Energy Solutions

## અદાણી એનર્જી સોલુશન્સ લિમિટેડ

(અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ તરીકે અગાઉ જાણીતા)

#### ૧૧મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ

અદાણી એનર્જુ સોલુશન્સ લિમિટેડ (અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ તરીકે અગાઉ જાણીતા) ની ૧૧મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ), કંપની અધિનિયમ, ૨૦૧૩ ની લાગુ જોગવાઈઓ અનુસાર તથા મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના નવીનતમ પરિપત્ર નં ૦૯/૨૦૨૩ તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩, પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તા. टभी એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અંતર્ગત તથા સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧, પરિપત્ર નં. SEBI/HO/DDH/P/CIR/2022/0063 તા. ૧૩મી મે, ૨૦૨૨, પરિપત્ર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/001 ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં. SEBI/HO/CFD/ CFD-PoD-2/P/CIR/2023/167 9મી ઓક્ટોબર, ૨૦૨૩ ના અંતર્ગત મંગળવાર ૨૫મી જૂન, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી)/ અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્ધારા ચોજાશે, જેમાં એજીએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ ધરાશે.

१९भी એજુએમની ઇલેક્ટ્રોનિક નોટિસ કે જેમાં પદ્ધતિ તથા ઈ-વોટિંગના સૂચનો વર્ણવવામાં આવશે તે કંપનીના વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક અહેવાલ સાથે એજ સભ્યો ને મોક્લવામાં આવેશે , જેઓને ઇમેઇલ કંપની / તેઓના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાચેલ છે.

જે સભ્યોના ઇમેઇલ નોંધાયેલા નથી તેઓએ વહેલી તકે નોંધણી કરાવવી જોઈએ.

वार्षिङ अहेवाल भेणववा माटे तथा छलेड्ट्रोनिङ भतहान माटेनी लोग-र्धन विगतो माटे नीचे हर्शावेल સૂચનાઓનું પાલન કરવાનું રહેશે:

- એ) જેઓના શેર ડિમેટ માધ્યમ છે: તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધણી કરાવી શકે છે.
- બી) જેઓના શેર ફિઝિકલ માધ્યમ છેઃ (i) કંપની રેજ્યસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજેન્ટ લિંક ઈનટાઈમ ઇન્ડिયા પ્રાઈવેટ લિમિટેડ ને પોતાના ફોલિયો નંબર તથા સ્વધિકૃત પાન સાથે અરજી કરી શકે છે. આ અરજી લિંક ઈનટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ , પાંચમો માળ , ૫૦૬-૫૦૮ અમરનાથ બીઝ્નેસ્સ સેંટર -9, (એબીસી-9), ગાલા બીઝ્નેસ્સ સેંટર ની બાજુમાં, એલિસબ્રિજ, અમદાવાદ - 3૮૦૦૦૬ ને મોક્લવાની રહેશે અથવા ahmedabad@linkintime.co.in ઉપર ઇમેઇલ પણ કરી શકે છે.

જે સભ્યો ડિમેટમા શેર ધરાવે છે તેઓ માત્ર ૧૧મી એજીએમની નોટિસ તથા વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક અહેવાલ મેળવવાના હેતુસર, ઉપર વર્ણવેલ ઇમેઇલ આઈડી પર ઇમેઇલ કરીને પોતાનો મેલ નોંધણી કરાવી શકે છે.

કંપની ઇલેક્ટ્રોનિક મતદાન માટેની સુવિધા સભ્યોને પુરી પડશે. ૧૧મી એજીએમ માં ભાગ લેવા માટે ના સૂચનો તથા ઈ-વોટિંગ કરવા માટેની પદ્ધતિ ( જે સભ્યો ફિઝિક્લ શેર્સ ધરાવે છે, અથવા જેમનો ઇમેઇલ નોંધાયેલ નથી તેઓ માટે પણ) ૧૧મી એજીએમ ની નોટિસ વર્ણવવામાં આવશે.

૧૧મી એજીએમની નોટિસ તથા વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.adanienergysolutions.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com તથ www.nseindia.com ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અદાણી એનર્જી સોલુશન્સ લિમિટેડ વતી (અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ તરીકે અગાઉ જાણીતા)

જલિધ શુક્લ સ્થળ: અમદાવાદ

તારીખ: ૨૫મી મે, ૨૦૨૪ કંપની સેક્રેટરી

**રજીસ્ટર્ડ ઓફિસઃ** "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત.

ફોલ લં.: ૯૧ ૭૯ ૨૫૫૫ ૭૫૫૫ | ફેક્સ લં.: ૯૧ ૭૯ ૨૫૫૫ ૭૧૭૭ จัดสเฮระ <u>www.adanienergysolutions.com</u> | สโซเฮซาสะ L40300GJ2013PLC077803

#### 中 HDFC BANK કિમાન્ક એચડીએફસી બેન્ક લિમિટેડ બ્રાન્થ : એચડીએફસી બેન્ક, ટ્રાયડેન્ટ, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૭. ફોન : ૦૭૯-૬૪૮૦૭૯૯

सिक्योरिटार्राभेशन गेन्ड रीकन्स्ट्रक्शन ओक् इायनान्सियल गेसेट्स गेन्ड गेन्डोर्समेन्ट ओक् सिक्योरिटी र्वन्टरेस्ट गेक्ट,

२००२ (એક્ટ)नी કલમ १३(२) અંતર્ગત સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ३६२ २००२ ના નિયમ ३ साथे पांचतां અહીં નીચે સહી કરનાર **અંચકોએફસી બેન્ક લિમિટેક** (બૂતકાળમાં **એચકોએફસી લિ., જેનું** નામદાર એનસીએલટી-મુંબઈ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના આદેશ મુજબ મંજુર થયેલ એકીકરણ યોજના અનુસાર **એચકીએફસી બેન્ક લિમિટેક** સાથે એકીકરણ થયેલ છે) ના અધિકૃત અધિકારીઓ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રફશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફીર્સમેન્ટ બોફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના નિયમઉ સાથે વાંચતા કલમ૧૩(૧૨) હેઠળ તેમને મળેલ સત્તા હેઠળ; અહીં નીચે દર્શાવેલ મોરોઅર(સી)લીગલ વારસદાર(રો) લીગલ પ્રતિનિધિ(ઓ) ને ઉપરોક્ત એક્ટ કલમ ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવેલ છે. જે અનુસાર જે તે ડિમાન્ડ નોટિસમાં નોટિસ મળ્યા તારીખથી eo દિવસમાં નીચેની વિગતે રકમ ચૂકવવા જુણાવેલ છે. નીચે સહી કરનારને ઉપરોક્ત બોરોઅર(સી લીગલ વારસદાર(રો) (લીગલ પ્રતિનિધિ(એ))ને છેલ્લામાં છેલ્લા જાણીતા સરનામાનાં સ્થળે આ નોટિસ ચોંટાડવાની કરજ પડેલ. આ નોટિસોની નકલ નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે અને ઉપરોક્ત બોરોઅર(સી લીગલ વારસદાર(રો)/પ્રતિનિધિ(ઓ) જો ઈચ્છો તો તેઓ નીચે સહી કરનાર પાસેથી જે તે નકલ ઓફિસ કામકાજના દિવસોએ કામકાજના સામાન્ય સમય દરમિયાન મેળવી શકે છે.

ઉપરોક્ત બાબતના અનુસંધાનમાં આ સાથે કરી એકવાર બોરોઅર(સે))લીગલ વારસદાર(રો)/લીગલ પ્રતિનિધિ(ઓ)ને નોટિસમાં આપવામાં આવે છે કે આ નોટિસ પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસમાં અહીં નીચે તેમના જે તે નામે દર્શાવેલ ૨કમ ડિમાન્ડ નોટિસમાં દર્શાવ્યા મુજબની, નીચે કોલમ (સી)માં દર્શાવેલ તારીખથી ચુકવાય તે તારીખ સુધીની ૨કમ **એથકીએફસી**માં જમા કરાવવાની રહેશે. જેમાં, વધારાનું વ્યાજ અને પ્રાસંગિક ખર્ચા, કોસ્ટ, ચાર્જિસ, એક્સ્પેન્સીસ, વગેરે બાકી નીકળતી તારીખથી સંપૂર્ણ ચુકવણી કરાય/જમા થાય ત્યાં સુધીના ગણતરીમાં લેવામાં

બોરોઅર(ર્સ)/ કાયદેસરના વારસદાર(રો)/ કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નું ધ્યાન દોરવામાં આવે છે કે એક્ટની કલમ-૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ અનુસાર સમય રહેતાં પોતાની સલામત અસ્કયામત/છોડાવી લે.

અનુ. નં.	બોરોઅર(સે)/ગેરન્ટર(સે) કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	કુલ બાકી લેણી રકમ	ડિમાન્ડ નોટિસ તારીખ	સ્થાવર અસ્કયામત(તો) સ્થાવર મિલકતોનું વર્ણન
(એ)	(બી)	(સી)	(8)	(6)
q	ડો. ચોગેશ આર. પ્રજાપતિ (બોરોઅર) શ્રીમતી રૂપલબેન ચોગેશકુમાર પ્રજાપતિ (કો-બોરોઅર) મે. વાત્સલ્ય કોસ્પિટલ & સોનોગ્રાફી સેન્ટર (કો-બોરોઅર) ૧૬૪૧૬૫ - ૬૩૫૨૯૩૯૫૯, ૬૩७૫૩૯૯૮૩, ૬૪૩૬૬૨૭૬૫ અને ૬૪૩૯૬૪૮૬૭	રૂા. દ્૧,૯૬,७८૯/-, રૂા. ૨,૨૯,७૨૫/-, રૂા. ૨૮,૩૧,૮૦૩/- અને રૂા. ૧,૦૨,૮૨૩/- અનુક્રમે ૩૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ <sup>8</sup>	૮ મે, ૨૦૨૪	યુનિટ-૦૪-ગ્રાઉન્ડ ફ્લોર, વેદાંત એઓન, પ્લોટ એફ. પી ફવ/ (૧ + ૨), સ. નં. ૯૯/પી, વેદાંત એઓન, એસ.પી. રીંગ રોડ, કરાઇ કોસ રોડ, પેટ્રોલ પંપ પાસે, નાના ચિલોડા, અમદાવાદ- ૩૮૨૩૩૦.
ą	શ્રી દિલીપ રેલ્લુમલ ચેલ્લાની (બોરોઅર) ૧७૩૩૨૫ - દ્ર૩૩૮૧૦૪૫૧, દ્ર૩૪૨૯૫૦૪૬ અને દૂપ૮૦૪૦૩૧૬	રૂા.૨७,૩७,૬૧૨/-, રૂા.૧,૧૧,७૧૪/- અને રૂા.૮૦,૮૯૯/- અનુક્રમે ૩૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ <sup>8</sup>	૧૪ મે, ૨૦૨૪	૧૩૦, પહેલો માળ, સુમેલ બિઝનેસ પાર્ક - IV, પ્લોટ એફ. પી દ્રર, સ. ર્ન ૧૭૨ + ૧૭૩/પી, ટી.પી. ૧૬, અરવિંદ મિલ પાસે, નરોડા રોડ, નરોડા, અમદાવાદ - ૩૮૨૩૩૦.

બાકી રકમ ચૂકવાય / જમા થાય તે તારીખ સુધીમાં લાગુ પડતું ચઢતું વધારાનું વ્યાજ, પ્રાસંગિક ખર્ચા, ચાર્જિસ, અન્ય ખર્ચા, વગેરે ગણતરીમાં લેવાશે.

જે ઉપર દર્શાવ્યા મુજબની ચુકવણી કરવામાં દેવાદારો નિષ્કળ જશે તો **એચડીએફલી** દ્વારા ઉપરોક્ત સિક્યોર્ડ અસ્કયામત(તો),સ્થાયી મિલકત(તો) સામે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૧૪) અને શત્રુ પડતા તમામ નિયમો હેઠળ કામકાજ કરવામાં આવશે. જો બોરોઅર(સી)લીગલ વાસરદાર(રો)/લીગલ પ્રતિનિધિ(ઓ) ના ખર્ચે અને જોખમે કરાશે.

એજાકીએફસી ની લેખિત પૂર્વ સંમતિ વગર ઉપરોક્ત બોરોઅર(સ)/લીગલ વારસદાર(રો)/ લીગલ પ્રતિનિધિ(ઓ)ના ઉપરોક્ત કાયદા હેઠળ ઉપરોક્ત સલામત અસ્ક્યામત(તો) સ્થાપી મિલકત(તો) વેચાલ, લીઝ કે અન્ય કોઈપણ રીતે ટ્રાન્સકર કરી શકશે નહીં. કાયદા કે નિયમો હેઠળની જોગવાઈનું કોઈપણ વ્યક્તિ ઉલ્લંઘન કરશે કે ઉલ્લંઘન કરવા પ્રોત્સાહિત કરશે, તો તેઓ કાયદા હેઠળની જોગવાઈ અનુસાર જેલની સજા અને /અથવા પેનલ્ટીની સજાને પાત્ર ઠરશે. વતી, એચડીએફસી બેન્ક લિ.

તારીખઃ ૨૪-૦૫-૨૦૨૪ રથળઃ વડોદરા / અમદાવાદ

અધિકૃત અધિકારી

## METROGLOBAL LIMITED

Regd. Office: 506-509, Shilp, Opp. Girish Cold Drinks, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat. METROGLOBAL Email: cs@metroglobal.in, Website: www.metrogloballimited.com, CIN: L21010GJ1992PLC143784

STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2024

(Rs. In Lakhs excep										except EPS)	
1057		STANDALONE				CONSOLIDATED					
Sr. No.	Particulars	Quarter Ended		Year Ended		Quarter Ended			Year Ended		
NO.	1 diticulai 5	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1 2	Total Income Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	6,583.90	7,118.51	8,023.67	24,592.43	24,772.26	6,593.36	7,120.50	8,023.78	24,604.51	24,772.97
3	Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.81
4	Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or	1,036.94	521.97	911.93	2,090.04	2,428.10	1,059.68	519.74	911.29	2,130.09	2,433.81
5	Extraordinary items) Total Comprehensive income for the	792.86	403.38	719.49	1,588.64	1,907.49	815.38	401.04	718.80	1,628.49	1,913.14
6	period Equity share capital (Face Value of	727.71	1,248.73	(931.09)	3,650.98	476.02	761.73	1,253.74	(852.77)	3,730.48	560.68
7	Rs 10/- each ) Reserve and Surplus (excluding Revaluation Reserve) Earnings Per Share (EPS) (of Rs.	1,233.44	1,233.44	1,233.44	1,233.44 35,726.55	1,233.44 32,383.93	1,233.44	1,233.44	1,233.44	1,233.44 35,801.37	1,233.44 32,387.65
	10 Each) (Not annualized for Quarters) (Including Other Comprehensive Income) a) Basic b) Diluted	5.90 5.90	10.12 10.12	(7.55) (7.55)	29.60 29.60	3.86 3.86	6.18 6.18	10.16 10.16	(6.91) (6.91)	30.24 30.24	4.55 4.55

The above financial results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at its meeting held on May 24, 2024. The standalone and

consolidated financial results of the Company have been audited by the Statutory Auditors of the company.

2 These financial results have been prepared in accordance with applicable Indian Accounting Standards ("Ind As") notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended, as specified in section 133 of the Companies Act, 2013.

The Board of Directors have recommended a dividend of Rs. 2/- @20% per Equity share of face value of Rs. 10/- each, subject to approval from the shareholders at the

Previous period figures have been regrouped/rearranged whenever necessary for comparison purposes The Financial Results are available on the BSE Limited website www.bseindia.com & on the company's website www.metrogloballimited.com

Date: May 24, 2024

Chairman & Managing Director DIN: 00160167

## 250<sup>®</sup> Ambalal Sarabhai Enterprises Limited<sup>®</sup> CIN: L52100GJ1978PLC003159

Regd. Office: Shanti Sadan, Mirzapur Road, Ahmedabad - 380001

Phone: 079-25507671, 25507073 | Website: www.ase.life | E-mail: ase@sarabhai.co.in

## EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

			Quarter ended	Year ended			
Sr. No.	Particulars	31.03.2024	31.03.2024 31.12.2023		31.03.2024		
		Audited	Unaudited	Audited	Audited	Audited	
1	Total Income from Operations (Including Other Income)	5913.49	4447.35	4880.01	18394.52	18277.28	
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	829.10	203.44	715.08	665.10	1517.21	
3	Net Profit / (Loss) for the period before tax and after exceptional items	829.10	203.44	715.08	665.10	1517.21	
4	Net Profit / (Loss) for the period after tax and exceptional items	901.83	133.28	571.16	568.07	1144.79	
5	Total Comprehensive Income for the period {Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)}	922.12	108.81	538.94	632.65	1071.21	
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- Per Share)	7663.33	7663.33	7663.33	7663.33	7663.33	
7	Other Equity as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	6049.95	5428.98	
8	Earnings Per Share (of ₹10/- each) Basic and Diluted Earning Per Share (Not Annualized) (in ₹)	1.18	0.18	0.76	0.74	1.49	

(₹ in Lakhs) 1. Key numbers of Standalone Results are as under: Quarter ended **Particulars** 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 31.03.2023 Unaudited Audited Audited Audited Audited Total Income from Operations (including Other Income) 440.54 165.24 371.53 1424.07 1170.34 Net Profit / (Loss) before tax 266.18 (38.46)122.92 81.45 433.67

Net Profit / (Loss) after tax 469.72 (65.09)111.65 258.32 411.07 2. The above is an extract of the detailed format of the Financial Results for the Quarter and year ended March 31, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results are available on the website of the Stock Exchange (www.bseindia.com) and the

- Company's Website (www.ase.life). 3. The above financial results have been reviewed by the Audit Committee at their meeting held on 24th May, 2024 and approved by the
- Board of Directors at their meeting held on 24th May, 2024. These results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS) prescribed
- under Section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
- 5. The figures for the previous periods have been regrouped wherever necessary to conform to the current period's classification.

For. Ambalal Sarabhai Enterprises Limited Kartikeya V. Sarabhai

Place: Vadodara Chairman

















Date: 24.05.2024